

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ

બોર્ડ બેઠક નં.-૧૬૩, તા.૨૩-૦૩-૨૦૨૧ના રોજ ૧૨-૦૦ કલાકે

અનુક્રમણિકા

મુદ્દા નં.	ઠરાવ નં.	વિગત	પાના નંબર
૧	૧૮૭૧	તા. ૧૧-૧૨-૨૦૨૦નાં રોજ યોજાયેલ બોર્ડ બેઠક નં.-૧૬૨મી બોર્ડ બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા બાબત.	૧
૨	૧૮૭૨	તા.૧૧-૧૨-૨૦૨૦નાં રોજ યોજાયેલ સત્તામંડળની ૧૬૨મી બોર્ડ બેઠકની કાર્યવાહી નોંધમાં થયેલ ઠરાવોની અમલવારીની સમીક્ષા કરવા બાબત.	૧
૩	૧૮૭૩	સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૩૮/૨ (મનહરપુર - રોણકી)ની સત્તામંડળ દ્વારા અધિનિયમ - ૧૮૭૬ તથા નિયમો - ૧૮૭૯ હેઠળ કાર્યવાહી કરી કલમ - ૪૨(૧) હેઠળ રાજ્યપત્રમાં અને દૈનિક પત્રોમાં કરાયેલ પ્રસિધ્ધિની કાર્યવાહીને બહાલ રાખવા તથા અધિનિયમ-૧૮૭૬ની કલમ-૪૭ હેઠળ મળેલા વાંધા સૂચનો અને રજૂઆતો માટે નિર્ણય કરવા અને અધિનિયમ-૧૮૭૬ની કલમ-૪૮(૧) હેઠળ રાજ્ય સરકારશ્રીને મંજૂરી અર્થે સાદર કરવા બાબત.	૨ થી ૩
૪.	૧૮૭૪	સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૪૧ (સોખડા-માલીયાસણ)ની સત્તામંડળ દ્વારા અધિનિયમ-૧૮૭૬ તથા નિયમો-૧૮૭૯ હેઠળ કાર્યવાહી કરી કલમ-૪૨(૧) હેઠળ રાજ્યપત્રમાં અને દૈનિક પત્રોમાં કરાયેલ પ્રસિધ્ધિની કાર્યવાહીને બહાલ રાખવા તથા અધિનિયમ-૧૮૭૬ની કલમ-૪૭ હેઠળ મળેલા વાંધા સૂચનો અને રજૂઆતો માટે નિર્ણય કરવા અને અધિનિયમ-૧૮૭૬ની કલમ-૪૮(૧) હેઠળ રાજ્ય સરકારશ્રીને મંજૂરી અર્થે સાદર કરવા બાબત.	૪ થી ૫
૫.	૧૮૭૫	સત્તામંડળનાં સમગ્ર શહેરીકરણ વિસ્તારમાં સૂચિત કરાયેલ નગર રચના યોજના નં.-૭૭ (વાજડીગઢ)ની સૂચિત કરાયેલ હદમાં ફેરફાર કરવા બાબત.	૬
૬.	૧૮૭૬	મંજુર/અમલી દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના-૨૦૩૧ની દરખાસ્તમાં ઊંચામાં ફેરફાર કરવા અંગે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૮૭૬ની કલમ-૧૯ હેઠળ દરખાસ્ત કરવા બાબત.	૭ થી ૧૧
૭.	૧૮૭૭	ખંઢેરી રેલ્વે સ્ટેશન તથા જામનગર રોડથી AIIMS હોસ્પિટલને જોડતા ૩૦.૦૦મી. ડી.પી. રસ્તાનું બ્રીજ સાથેના કામ બાબત.	૧૨ થી ૧૩
૮.	૧૮૭૮	સત્તામંડળના નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના સુધારેલ અંદાજો તથા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના અંદાજપત્રને બહાલી આપવા બાબત.	૧૪ થી ૩૯

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ
બોર્ડ બેઠક નં.-૧૬૩, તા.૨૩-૦૩-૨૦૨૧ના રોજ ૧૨-૦૦ કલાકે

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની તા.૨૩-૦૩-૨૦૨૧નાં રોજ યોજાયેલ એકસો ત્રેસઠ
(૧૬૩)મી બોર્ડ બેઠકની કાર્યવાહીની નોંધ.

અધ્યક્ષશ્રી, રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના પ્રમુખ સ્થાને સત્તામંડળની ૧૬૩મી બોર્ડ બેઠક તા.૨૩-૦૩-૨૦૨૧ને મંગળવારનાં રોજ ૧૨-૦૦ કલાકે યોજાયેલ, જેમાં નીચે મુજબની વિગતે અધ્યક્ષશ્રી તથા સભ્યશ્રીઓ હાજર રહેલ.

- | | | |
|----|---|---|
| ૧. | શ્રી ઉદીત અગ્રવાલ
(આઇ.એ.એસ.) | અધ્યક્ષશ્રી, રૂડા અને
મ્યુનિસીપલ કમિશ્નરશ્રી,
રાજકોટ મહાનગરપાલિકા,
રાજકોટ. |
| ૨. | શ્રી એચ.સી.તન્ના
(કલેક્ટરશ્રી, રાજકોટના પ્રતિનિધિ) | મામલતદારશ્રી
કલેક્ટર કચેરી,
રાજકોટ. |
| ૩. | શ્રી એન.એફ.ચૌધરી
(પ્રાદેશિક કમિશ્નરશ્રી,
રાજકોટના પ્રતિનિધિ.) | એડી.કલેક્ટરશ્રી
નગરપાલિકાઓ,
રાજકોટ વિભાગ. |
| ૪. | શ્રી એ.કે.રાવ.
(મુખ્ય નગર નિયોજકશ્રી
ગાંધીનગરના પ્રતિનિધિ) | નગર રચના અધિકારી
પ્રવર નગર નિયોજકશ્રી,
રાજકોટ નગર રચના યોજના,
રાજકોટ. |
| ૫. | શ્રી એચ.યુ.દોઢીયા | સીટી એન્જીનીયરશ્રી,
રાજકોટ મહાનગરપાલિકા,
રાજકોટ. |
| ૬. | શ્રી ભુપતભાઈ જસમંતભાઈ બોદર | પ્રમુખશ્રી,
જિલ્લા પંચાયત,
રાજકોટ |

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ

બોર્ડ બેઠક નં.-૧૬૩, તા.૨૩-૦૩-૨૦૨૧ના રોજ ૧૨-૦૦ કલાકે

૭.

શ્રી ચેતન બી. ગણાત્રા

સભ્ય સચિવશ્રી અને

મુખ્ય કારોબારી અધિકારીશ્રી,

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ,

રાજકોટ

બેઠકની શરૂઆતમાં સભ્ય સચિવશ્રી અને મુખ્ય કારોબારી અધિકારીશ્રીએ આજની બેઠકમાં હાજર રહેલ તમામ સભ્યશ્રીઓને આવકારી કોરમ પૂર્ણ થતા માન. અધ્યક્ષશ્રીની અનુમતીથી એજન્ડા મુજબની કાર્યવાહી શરૂ કરવામાં આવી.

આજની બેઠકમાં નીચે જણાવ્યા મુજબના મુદ્દાઓની ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવામાં આવેલ છે.